



RAN-2408000105051016

T.Y.B.Com. (Sem. - V) Examination December - 2025

Tax Procedure and Practice - Paper VI

[Total Marks: 25]

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર. 1 (a) બહુવિધ પસંદગીના પ્રશ્નો.

(3)

- SGST હેઠળ ઇલેક્ટ્રોનિક કેડિટ લેજરમાં બેલેન્સનો ઉપયોગ કઈ જવાબદારી સામે થઈ શકે છે
 - માત્ર SGST જવાબદારી
 - SGST અને IGST જવાબદારી
 - SGST, IGST અને CGST જવાબદારી
 - ઉપરના બધા
- _____ પર વ્યાજ ચૂકવવાપાત્ર છે :
 - કરની વિલંબિત ચૂકવણી.
 - ઈનપુટ ટેક્સ કેડિટનો અયોગ્ય /અધિક દાવો.
 - આઉટપુટ ટેક્સ જવાબદારીમાં અયોગ્ય /અતિશય ઘટાડો.
 - ઉપરોક્ત તમામ.
- આકારણીનો અર્થ છે જોગવાઈઓ અને અધિનિયમ અનુસાર કર જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા, જેમાં સમાવેશ થાય છે.
 - કામચલાઉ આકારણી
 - સ્વ-મૂલ્યાંકન
 - પુનઃમૂલ્યાંકન
 - ઉપરોક્ત તમામ.

(b) નીચેનાનો મેળ કરો.

(4)

કોલમ-I	કોલમ-II
1. કર સત્તાવાળાઓ દ્વારા ઓડિટ	A કલમ. 54
2. રેકર્ડ ની ચકાસણી	B કલમ.125
3. સામાન્ય દંડ	C કલમ. 65
4. ટેક્સનું રિફંડ	D કલમ. 61

- પ્ર. 2 ટૂંકમાં જવાબ. (કોઈપણ બે)** (4)
1. GST માં આકારણીના પ્રકારો જણાવો.
 2. પૂર્ણ સ્વરૂપ આપો: CIN, CPIN, BRN અને OTC?
 3. ટેક્સ સત્તાવાળાઓ દ્વારા ઓડિટ શું છે?
 4. રિફંડની અરજ સાથે અપલોડ કરવાના બે દસ્તાવેજો જણાવો?
 5. કલમ 125 મુજબ સામાન્ય દંડ શું છે.
- પ્ર. 3 જવાબ (કોઈપણ એક)** (7)
- (a) ઇલેક્ટ્રોનિક રોકડ ખાતાવહી શું છે? ઇલેક્ટ્રોનિક રોકડ ખાતાવહી માં ઉપલબ્ધ રકમના ઉપયોગ જણાવો
 - (b) રિફંડ શું છે? રિફંડ અરજ કરવા તરફ દોરી જતી પરિસ્થિતિઓ જણાવો.
- પ્ર. 4 (a) ટૂંકી નોંધ લખો (કોઈપણ એક)** (4)
1. GST ની ચુકવણીમાં વિલંબ પર વ્યાજ. (કલમ.50)
 2. GST હેઠળ રિટર્ન ન ભરનારાઓનું મૂલ્યાંકન
- (b) ટૂંકી નોંધ લખો (કોઈપણ એક)** (3)
1. ખાસ ઓડિટ
 2. સંબંધિત સામાન્ય શિસ્ત

ENGLISH VERSION

- Q. 1 (a) Multiple Choice Questions.** (3)
1. Balance in electronic credit ledger under SGST can be used against which liability
 - (a) SGST Liability only.
 - (b) SGST and IGST Liability.
 - (c) SGST, IGST and CGST Liability.
 - (d) All of the Above
 2. Interest is payable on :
 - (a) Belated payment of tax.
 - (b) Undue/Excess claim of Input tax Credit.
 - (c) Undue / Excess reduction in Output tax liability.
 - (d) All of the above.
 3. Assessment means process of determining the tax liability in accordance with the provisions of the Act, which includes.
 - (a) Provisional Assessment.
 - (b) Self-assessment.
 - (c) Reassessment
 - (d) All of the above.

- (b) Match the Followings.** (4)

	Column-I		Column-II
1.	Audit by Tax Authorities	A	Sec.54
2.	Scrutiny of Records	B	Sec. 125
3.	General Penalty	C	Sec.65
4.	Refund of Tax	D	Sec.61

- Q. 2 Answer in Short (any two) (4)**
1. Mention the types of Assessment in GST.
 2. Give Full form of : CIN, CPIN, BRN and OTC ?
 3. What is Audit by Tax Authorities?
 4. Mention two documents to be uploaded along with refund application?
 5. What is General Penalty U.Sec-125
- Q. 3 Answer (Any one) (7)**
- (a) What is Electronic Cash Ledger? Mention the Usage of amount available in Electronic Cash ledger?
 - (b) What is Refund under GST ? Mention the Situations leading to refund application .
- Q. 4 (a) Write Short Note (any one) (4)**
1. Interest on delay Payment of GST. (Sec.50)
 2. Assessment of non-filers of Return under GST
- (b) Write Short Note (any one) (3)**
1. Special Audit.
 2. General disciplines related to penalty.
-